

સ્ત્રી(બાળકી)ની સુન્નત: ઓસ્ટ્રેલિયામાં એક ગુનો

દુનિયાના 48થી વધુ દેશોમાં જુદા-જુદા કારણોસર સ્ત્રીની જનનેન્દ્રિયનું છેદન (ફીમેલ જેનાઈટલ મ્યુટિલેશન -FGM) કરવામાં આવે છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં તે એક ગુનો છે.

મે 2014માં, NSWની વિધાનસભાએ FGM વિરુદ્ધ ગુનાઓનું સુધારણા બિલ 2014માં પસાર કર્યું હતું અને તેના દોષી ઠરેલ કોઈ પણ વ્યક્તિની સજા વધારીને 21 વર્ષની કરી હતી.

FGM વિરુદ્ધ NSWનો કાયદો કહે છે કે આમ કરવું ક્રિમિનલ એક્ટ હેઠળ એક ગુનો છે:

- કોઈ બાળકી, છોકરી કે સ્ત્રી પર FGM કરવું.
- સુન્નત કરાવવા માટે કોઈ બાળકી કે સ્ત્રીને NSWની બહાર લઈ જવી
- કોઈને એમ કરવા માટે નાણાં ચૂકવવા
- અથવા કોઈને એમ કરવાની સલાહ આપવી

2^{જી} જાન્યુઆરી, 2014ના રોજ, એક ઈન્ડોનેશિયન પિતા મેન્લી કોર્ટ, NSWમાં હાજર થયાં હતાં, અને તેમના પર તેઓ જ્યારે તેમની બાળકીને પરદેશ લઈ ગયા ત્યારે તેની જનનેન્દ્રિયનું છેદન કરવા માટે કોઈ વ્યક્તિની વ્યવસ્થા કરવાના ગુનાસર કામ ચાલ્યું હતું.

એક જુદા કેસમાં 24^{મી} મે, 2014ના રોજ, સિડનીના ભારતીય સમુદાયના એક નાનકડા સંપ્રદાયની એક નિવૃત્ત નર્સ, એક ઈમામ અને એક માતા પર ઓસ્ટ્રેલિયામાં બે નાની છોકરીઓની સુન્નત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

સ્ત્રીની સુન્નત /FGMના 4 મૂળ પ્રકાર છે:

પ્રકાર I

ભગ્નશિશ્ન (યોનિનો આગળનો ઉપસેલો ભાગ) ના આખા અથવા આંશિક છેદન સાથે અથવા વિના, શિશ્નમણિછદ (યોનિના આગળના ભાગ)નું છેદન (ક્લિટોરિડેક્ટોમી).

પ્રકાર II

લઘુ ભગ્નના આંશિક અથવા પૂર્ણ છેદન સાથે ભગ્નશિશ્નનું છેદન (સુન્નત).

પ્રકાર III

બાલ્ય જનનેન્દ્રિયનું આખું અથવા આંશિક છેદન અને યોનિમુખને સીવી દેવું/ સાંકડુ કરી દેવું (ઈન્ફિબ્યુલેશન)

પ્રકાર IV અવર્ગીકૃત:

- ભગ્નશિષ્ન અને/અથવા લઘુ ભગોષ્ઠને કોચવા, વીંધવા અથવા તેનું છેદન કરવું
- ભગ્નશિષ્ન અને/અથવા લઘુ ભગોષ્ઠને પલોળાં કરવા
- ભગ્નશિષ્ન અને તેની આસપાસની પેશીને ડામ દઈને બાળી નાંખવા
- યોનિની આજુબાજુની પેશીને ચીરી નાંખવી (ગિશરી કાપા)

આ પ્રક્રિયા થાય એ સમયથી સ્ત્રીની તેણીની આખી જિંદગી સુન્નતની સ્ત્રીના આરોગ્ય પર અનેક નુકસાનકારક આડઅસરો થયાં કરે છે.

જ્યારે કોઈ પણ ધાર્મિક પુસ્તક: દા.ત. તોરાહ, બાઈબલ અને કુરાનમાં સ્ત્રીની સુન્નત કરવાની વાત નથી, ત્યારે કેટલાંક મુસલમાન ધર્મગુરૂઓ કે જેઓ આ રિવાજને સમર્થન આપે છે, તે એવો દાવો કરે છે કે આ ઈસ્લામના બોધ પ્રમાણેની એક જરૂરિયાત છે.

તેમ છતાં, 22^{મી} અને 23^{મી} નવેમ્બર 2006ના રોજ દુનિયાના અનેક ઉચ્ચ સ્થાન પરના મુસલમાન ધર્મગુરૂઓ ઈજિપ્તના મહા મુક્તિ, પ્રોફેસર ડૉ. અલી ગોમાની મુરબ્બીવટ હેઠળ અલ અઝર યૂનિવર્સિટીમાં એક કોન્ફરન્સ દરમિયાન મળ્યા હતાં.

સ્ત્રીઓના જનનાંગોના છેદનની નુકસાનકારક અસરો વિશે ઈજિપ્ત, ઈથિયોપિયા અને જર્મનીના અનેક આંતરરાષ્ટ્રીય ક્વિઝિશ્યનો દ્વારા અનેક તબીબી અહેવાલ પ્રસ્તુત થયા બાદ તેઓ બધાં સહમત થયા અને તેમણે ઘોષણા કરી કે સ્ત્રીના જનનાંગનું છેદન એ એક સજાપાત્ર હુમલો છે અને તે માનવતા વિરુદ્ધ એક અપરાધ છે અને આ રિવાજને હવે મુસલમાનો દ્વારા પાળવામાં આવવો જોઈએ નહીં.

કોન્ફરન્સમાંના ધાર્મિક વિદ્વાનોમાં સામેલ હતા:

- મહા મુક્તિ અને અલ-અઝરના પુરસ્કર્તા: પ્રોફેસર ડૉ. અલી ગોમા
- અલ-અઝરના વડા શેખ: પ્રોફેસર ડૉ. મોહમ્મદ સૈયદ તંતાવી,
- ઈજિપ્તના ધર્મ સંબંધી પ્રધાન: પ્રોફેસર ડૉ. મહેમૂદ હમ્દી ઝકઝૂક;
- ચાડના શેખ હિસીન હસન અબકર;
- માલીના ઈમામ મહમ્મદાઉ ડિઆલો
- મોરિશિઆનાના ઈમામ બલ અલબશીર;
- ઈથિયોપિયાના શેખ મોહમ્મદ દરાસા,
- ઓસ્ટ્રિયાના ઈમામ તરાફા બાઘરજાતી.

મે 2014માં, એક ઈજિપ્શિયન ડૉક્ટર પર જુલાઈ 2013માં એક 12 વર્ષની છોકરીની સુન્નત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામી હતી. આ કાયદો વર્ષોથી છે, છતાં, ઈજિપ્તમાં જેના વિરુદ્ધ કાર્યવાહી થઈ એવા એ પહેલા વ્યક્તિ હતા.

FGM વિશેનો NSWનો શૈક્ષણિક કાર્યક્રમ FGMથી પીડિત સ્ત્રીઓને NSWની આરોગ્ય સેવાઓમાં આરોગ્ય સંબંધી માહિતીના સત્ર દ્વારા મદદરૂપ થાય છે અને આરોગ્ય વિશેની ચર્ચાઓ માટે અનુકૂળતા કરી આપે છે, અને ભાગ લેનારાઓને પોતાના જીવન વિશે જાણપૂર્વકના નિર્ણયો લેવામાં અને પસંદગીઓ કરવામાં સક્ષમ બનાવે છે.

આ કાર્યક્રમ, દ્વિવભાષી સ્ત્રી તેમજ પુરૂષ, સામુદાયિક કાર્યકરોને સ્ત્રીઓ સાથે સ્ત્રીઓના આરોગ્ય વિશે એક 11 સેશનનો કાર્યક્રમ, અને પુરૂષો સાથે પુરૂષોના આરોગ્ય વિશે એક 7 સેશનનો કાર્યક્રમ ચલાવવા માટે રોકે છે અને પ્રશિક્ષણ આપે છે. બંને કાર્યક્રમોને સમુદાયના સભ્યો સાથે કઈ માહિતી NSWમાં સ્થિર થયેલ પરદેશીઓ માટે મહત્વની છે, અને કોણ એવી સંસ્કૃતિમાંથી આવે છે, જ્યાં FGM નો રિવાજ છે, તે બાબતે ચર્ચા કર્યા પછી તૈયાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમોમાં હાજરી આપનાર સ્ત્રીઓ અને પુરૂષોનો પ્રતિભાવ હકારાત્મક રહ્યો છે, જેમાં અનેક લોકો એવું પ્રાણ લે છે કે તેઓ FGMને રોકશે, અને ખાસ કરીને પોતાની દીકરીઓ પર તો FGM નહીં જ કરે.

અનેક લોકોએ પરદેશોમાં રહેતાં તેમના કુટુંબીઓ અને સગાંનો સંપર્ક કરીને તેમને FGM ની નુકસાનકારક અસરો વિશે અને તેમના સંબંધીઓને વતનમાં રહેતી તેમની દીકરીઓ સાથે આ રિવાજ બંધ કરવા માટે વિનંતી કેવી રીતે કરી છે તે જણાવ્યું છે.

વધુ માહિતી અથવા મદદ માટે કૃપા કરીને FGM વિશેના NSWના શૈક્ષણિક કાર્યક્રમનો આ નંબર પર સંપર્ક સાધો

(02) 9840 3877 અથવા (02) 9840 3910

અમારા કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે અમારી વેબસાઈટ પર જાવ: www.dhi.health.nsw.gov.au/fgm